

PAR/CS/NSE/2023-24/45

To,
The Manager
Listing department,
National Stock Exchange of India Limited
Exchange Plaza, C-1, Block-G,
Bandra Kurla Complex, Bandra (E),
Mumbai- 400 051
Maharashtra

Date:17/02/2024

Subject: Submission of Newspapers Cutting of published Standalone Unaudited Financial Results for the quarter & nine month ended 31st December, 2023

Ref.: Symbol- PAR, ISIN: INE04LG01015

Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose the cuttings of newspaper advertisement published in Newspaper dated February 17, 2024 in The Economic Times (English) and Navgujarat Samay (Gujarati), regarding Standalone Unaudited Financial Results for the quarter & nine month ended December 31, 2023

Copies of newspapers cutting in this connection are attached herewith.

The above information is also available on the website of the Company www.pardrugs.com

Kindly take on the record and acknowledge the receipt.

Yours Faithfully

For PAR DRUGS AND CHEMICALS LIMITED

(Sanket B. Trivedi)

Company Secretary & Compliance Officer



Green Signal for Vadhavan Port, to be Soon Taken up by Cabinet: Sonowal

New Delhi: The ₹76,000 crore Vadhavan Port has received environment Ministry's nod and it will now soon be sent for Cabinet approval according to Ports, Shipping, and Waterways Minister, Sarbananda Sonowal. Speaking to journalists in New Delhi, he said that a final approval from the Cabinet Committee on Economic Affairs (CCEA) will soon be obtained. The Project Investment Board (PIB) - which precedes a cabinet approval for large infrastructure projects - approved the project on Friday, officials told ET. "Vadhavan Port Projects Ltd. (VPPL) is a special purpose vehicle (SPV) with 74% stake of Jawaharlal Nehru Port Authority (JNPA), and 26% with Maharashtra Maritime Board. Of the ₹76,220 crore investment, ₹38,976 crore will be invested by SPV in infrastructure and ₹37,244 crore is expected from the private sector," Sonowal said. An 'in-principle' approval for the port was given by the Union cabinet in February 2020. The 24.5 million twenty-foot equivalent units (TEUs) capacity port will primarily be handling containers. —Our Bureau

AS INDO-PACIFIC ECONOMIC FRAMEWORK COMES INTO FORCE NEXT WEEK...

India Plans to Designate Rare Minerals, Pharma, Electronics as Critical Sectors

IN THE WORKS Move aims to secure them against any future supply chain disruption

Kirtika Suneja

New Delhi: India is eyeing designating rare earth minerals, electronics and pharmaceuticals as critical sectors to secure them against any future supply chain disruption.

The move comes ahead of the Supply Chain Resilience Agreement of the 14-member Indo-Pacific Economic Framework (IPEF) coming into force next week.

As per the agreement, the member countries have to identify critical sectors and key goods for cooperation up to 120 days after the date of the entry into force. The agreement will come into force on February 24, 2024.

"Inter-ministerial and industry consultations are going on. We are yet to take a call on the sectors," said an official.

IPEF has 14 members, including India, Australia, the US, Japan, Fiji, South Korea, New Zealand, Singapore and Thailand, represent-

Supply Chain Resilience

IPEF Supply Chain Resilience Agreement to come into force on Feb 24

■ 14 IPEF members need to identify sectors for supply chain security

■ India mulls pharma, electronics, critical minerals

■ Talks on with industry, worker organisations, civil society

■ Supply Chain Council, Emergency Response Network being set up



SANJEEV

ing 40% of the global gross domestic product and 28% of the global trade in goods and services.

As per the official, a structured mechanism is being identified to develop action plans to set up supply chain council and an emergency response network.

To facilitate cooperation among the members, the IPEF Supply Chain Agreement contemplates the establishment of three new IPEF supply chain bodies- the sup-

ply chain council, the supply chain crisis response network and the IPEF labour rights advisory board.

The proposed advisory board, comprising government, worker and employer representatives, and a subcommittee composed of government representatives, would support the IPEF partners' promotion of labour rights in their supply chains, promotion of sustainable trade and investment,

and facilitation of opportunities for investment in businesses that "respect labour rights".

Officials said that a multi-stakeholder task force comprising experts from academia, industry, civil society and workers' associations to make recommendations

on critical sectors important for India to propose to other IPEF members, is also in the works. The IPEF is structured around four pillars relating to trade, supply chains, clean economy and fair economy (issues such as tax and anti-corruption). India has joined all the pillars except the trade one.

Legal Scrubbing Process of Pillar III (Clean Economy), Pillar IV (Fair Economy) and Agreement on IPEF are underway.

kirtika.suneja@timesgroup.com

What Trend is the Declining Unemployment Rate Hiding?

Urban jobless rate fell to its lowest level in over four years in Q3FY24. But instead of cheers, it has raised concerns

Ishaan Gera

ET EXPLAINER

Urban unemployment rate declined to its lowest level in over four years to 6.5% in Q3FY24, according to the latest quarterly Periodic Labour Force Survey data released earlier this week. ET explains the indicators PLFS tracks and why even falling urban unemployment may be a cause of concern.

What is the Periodic Labour Force Survey?

The periodic labour force survey was launched in April 2017 by the National Sample Survey Office of the ministry of statistics and programme implementation to replace the annual employment and unemployment survey, based on the recommendations of the task force on employment, headed by the then vice-chairman of NITI Aayog Arvind Panagariya.

The survey has two components: an annual survey, which incorporates the results of rural and urban surveys and a quarterly survey, which records the results of an urban survey, the results of which are usually made available by the next quarter.

The annual survey runs from July to June, whereas the government recently released the results of the 21st quarterly survey for the October to December 2023 period. The survey compiles data from nearly 45,000 households comprising around 170,000 individuals from urban areas for each quarter, es-

timating employment and unemployment indicators.

What does PLFS track?

Besides unemployment figures, PLFS also tracks labour force participation, worker population ratio and distribution of workers in broad employment categories and according to industry of work across age groups in 22

The declining unemployment has been accompanied by a rise in people in the self-employed category, which went up to 40.6% in Q3FY24 from 39.6% in the third quarter of FY23. Within the self-employed category, the proportion of people employed as helpers in households went up to 6.7% from 5.9% earlier

states and UTs.

For the quarterly survey, the estimates are calculated based on the current weekly status, which measures the number of persons either employed or unemployed on an average in a week of seven days preceding the date of the survey.

What do the latest results show?

The urban unemployment rate declined to 6.5% in Q3FY24 compared with 7.2% in the year-ago period. The female unemployment rate declined to 8.6% from 9.6%, whereas the male unemployment rate reduced to 5.8% from 6.5%. Female labour force participation shot up to 25% for people aged 15 and above, and male labour force participation increased to 74.1% from 73.3% in Q3FY23.

Why is there a problem with falling unemployment?

The declining unemployment has been accompanied by a rise in people in the self-employed category, which went up to 40.6% in Q3FY24 from 39.6% in the third quarter of FY23. Within the self-employed category, the proportion of people employed as helpers in households went up to 6.7% from 5.9% earlier.

While the proportion of men as regular wage workers has gone up, the proportion of women as regular wage employees has declined.

An ET analysis of 2022-23 PLFS data shows that the average earnings of a salaried employee were 18.4% higher than those in the self-employed category.

India Proposes Lower Cost of Cross-border Remittances at WTO

Kirtika Suneja

New Delhi: India has proposed a work programme at the WTO to lower the cost of cross-border remittances to promote international trade.

In a submission made Tuesday, New Delhi said that one of the means to achieve cheaper, faster and more transparent and accessible cross-border payments including remittances is "promoting interoperability and interlinkages of digital payment infrastructures including fast payment systems". "Cost of remittance is an issue we have been raising. There is also a Sustainable Development Goal on this," said an official. Insisting that lower transaction costs are key to reduce inequality within and among countries India especially because the global average cost for sending remittances is 6.18%, more than twice the SDG target. The SDG goal is to reduce to less than 3% the transaction costs of remittances and eliminate remittance corridors with costs higher than 5% by 2030.

India said that one of the main factors explaining the growth and demand for cross-border payment services is the expansion in international remittances.

As per the submission, the global average cost for digital remittances at 4.84% is significantly lower than the cost for non-digital remittances and that out of total remittances of \$860 billion in 2023.

Authorised Capital of FCI Hiked

NEW DELHI: The central government has increased authorized capital in the Food Corporation of India (FCI) from ₹10,000 crore to ₹21,000 crore, according to a food ministry notification issued on Friday. "This will help the FCI in reducing its borrowings from banks and other institutions, leading to a saving of Rs 750 crore annually," said a senior FCI official. —SHAMBHAVI ANAND

NHAI Removes Paytm as Acquirer Bank

Yogima Seth

New Delhi: The National Highways Authority of India (NHAI) has decided to replace Paytm Payments Banks with other nine authorised banks to function as an acquirer bank at the national highways at 247 toll plazas.

An acquirer bank is a bank or financial institution that processes fastag payments at the toll plazas on behalf of the issuing bank and routes them through the payment networks to the issuing bank.

The move is aimed at ensuring that the entire toll collection ecosystem is not impacted across these plazas after February 29, a person familiar with the move told ET. The acquirer bank gets 0.13% of the daily collection as the programme management fees paid by NHAI.

The national highway users using Paytm FASTag

with balance in their accounts, on the other hand, will be able to use them for transactions only till March 15 after which they will have to migrate to FASTags of other banks for a hassle-free drive as per the latest clarification issued by the Reserve Bank.

India's average daily toll collection stands at ₹190 crore and Paytm Payments Bank managed 247 toll plazas contribute roughly 14% to the total toll collection. The move to derecognise Paytm Payments Bank from the list of both issuer bank and acquirer bank follows RBI's order on January 31 asking Paytm Payments Bank to stop all basic payment services from February 29.

A query sent to Paytm Payments Bank did not elicit any response till the press time.

The nine acquirer banks, authorised by the Indian Highways Management Company under NHAI and being considered for roll-over from Paytm Payments Bank.

NFRA's First Annual Inspection of Key Audit Firms to Start by April

Regulator to gauge Big Five's compliance with suggestions made in its Dec 2023 reports

Banikinkar Pattanayak

New Delhi: The National Financial Reporting Authority (NFRA) will initiate the first annual inspection of key audit firms—including the Big Five—latest by April, focussed on their processes and standards adopted, people aware of the regulator's thinking told ET.

The regulator will also gauge the Big Five's compliance with the suggestions made in its December 2023 reports in which it had flagged deficiencies in their work processes, including on non-audit services that they provide to the same companies of which they are the statutory auditors, one of the persons said.

It will select some other auditors as well for the inspections, based on certain "risk-based parameters" that it's finalising by using data analytics, ET has learnt.

Moreover, the regulator will lay emphasis on whether the auditors have effective communications with the audit committees of listed firms, mainly the large ones.

The heightened regulatory scrutiny aims to "ensure auditors follow not just the letter but also the spirit of law", he said.

It will bolster the audit and accounting ecosystem that is crucial to curbing corporate frauds and upholding shareholders' interests in a fast-growing economy, he added.

What the Inspections May Cover

Inspections to assess processes, audit standards compliance

Gauge if earlier suggestions adopted by auditors	Review of non-audit services provided to same clients

Focus on talks between auditors and audit panels of listed firms

The Big Five—EY, Deloitte, KPMG, PwC and Walker Chandio & Co—dominate the Indian audit ecosystem, having overseen assignments of three out of five Nifty-500 companies as of March 2023, according to a primeinfo base.com report.

Once the regulator wraps up its inspections, it will give the audit firms adequate time to submit their views on its findings before making the reports public.

Such a move by the audit watchdog would be in sync with global best practices.



एसजेवीएन ग्रीन एनर्जी लिमिटेड
SJVN Green Energy Limited
(A Wholly Owned Subsidiary of SJVN Limited)
CIN: U40100HP2022GOI09237

E-Tender No.: SGEL/CHQ/CONTRACTS/MODULES-ICB/2024
Online bids (E-tender) on International Competitive Bidding (ICB) are invited on behalf of SJVN Green Energy Limited for "MANUFACTURE AND SUPPLY OF SOLAR PV MODULES OF TOTAL 1960 MW, CAPACITY FOR SOLAR POWER PROJECTS TO BE INSTALLED IN VARIOUS STATES OF INDIA."

For details, visit websites: - <https://www.bharat-electronictender.com>, www.eprocure.gov.in and www.sjvn.nic.in. Last date for bid submission is **05.03.2024 (Time: 13:00 Hrs)**.

Amendment(s), if any, shall be issued on websites only.

DGM (Contracts)
SJVN Green Energy Limited, Corporate Headquarters, Shakti Sadan Shanan, Shimla (H.P) Email- contracts.sgcl@sjvn.nic.in

NOTICE FOR LOSS OF DOCUMENT & TITLE CLEARANCE

Notice to hereby given to the public that owner of under mention property owner Veena Sunil Gupta obtain financial facility from our client bank and decided to mortgage under mention properties to with our client bank. After taking title clearance report from me, said owner declared and informed that under mention original documents are lost/misplaced and not traceable now, that never ever it was used as security for obtaining any financial assistance by him or anyone else. If any person or persons, Society, Banks etc., owing any right of ownership or possession or lien or claim of whatever nature in respect thereof are hereby informed to raise any such rights or claims all within a period of 7 (seven) days from the date of publication of this notice personally before the undersigned at following address, alongwith all documentary proofs in original, upon expiry of which, no rights or claims or whatsoever nature shall be entertained. Thereafter, we will issue title clearance certificate regarding publication and our bank should have first rights and charge on the said Property.

PROPERTIES DESCRIPTION	LOSS OF DOCUMENTS
Property bearing Shop No. 1 Super Built Up admeasuring 330.00 sq.ft. Carpet admeasuring 227.00 sq.ft. i.e. 21.09 sq.mts on Ground Floor of Building No. A in the complex which is known as "Akshar Residency" alongwith undivided proportionate share underneath in land of the said complex situated at land bearing Revenue Survey No. 190, Re-Survey No. 16/1 and 16/2 admeasuring 12100.00 sq.mts, T.P Scheme No. 63, Final Plot No. 28 paki sub plot no. 1 admeasuring 3287.26 sq.mts of village Vadod, Sub Dist. Majura, Dist. Surat. Owner: Veena Sunil Gupta	Original Registration Receipt of Sale Deed No. 2444 on dated 22/02/2012.

Date :- 05-02-2024
Krupa C. Shah (Advocate)
Office: 415, Autograph The Commercial Hub, Opp. Milk Palace, Bhatar Road, Surat. I Mobile No. 8980022292

U.P. POWER TRANSMISSION CORPORATION LIMITED

CORRIGENDUM NOTICE
In reference to the Short Term E-tender No. ETC/MU/T-50/2023-24 & ETC/MU/T-51/2023-24 it is being informed that the Earnest Money (EMD) against E-tender No. ETC/MU/T-50/2023-24 for Rs. 2000000/- shall be 1677000/- & ETC/MU/T-51/2023-24 for Rs. 400000/- shall be 477000/- & Scheduled date of submission of bid from dated 21.02.2024 to 24.02.2024 & Scheduled date of opening of Part-I: 22.02.2024 to 26.02.2024. For Detailed information, please visit website www.etender.upncl.in for any corrections/amendments/modifications/ extensions till the date of submission of tender and thereafter. (Nikhil Kumar) Superintending Engineer, Electricity Transmission Circle, Muzaffarnagar. "Save Electricity in the interest of the Nation" वाचक/No. 238/विद्युत/ए.ए.सी. (MZN) दिनांक/DATED 15.02.2024

TELANGANA STATE ROAD TRANSPORT CORPORATION
e-TENDER NOTIFICATION
e-Tenders are invited for leasing of open land parcels of TSRTC on monthly license fee basis in prime locations in Hyderabad and Secunderabad twin cities at 1. Kachiguda, 2. Medchal, 3. Hakimpet Training College, 4. Shamirpet, 5. Rashedguda-1, 6. Rashedguda-2, 7. Chengicherla, 8. Turkayamjal-1 and 9. Turkayamjal-2. For details please visit website from 17.02.2024 to 06.03.2024, 16.00hrs. www.eprocurement.gov.in/ <https://tender.telangana.gov.in> <https://www.tsrtc.telangana.gov.in> to download e-procurement notification. TSRTC reserves the right to cancel / reject any or all the tenders without assigning any reasons thereof.
Sd/-
Executive Director
Greater Hyderabad Zone
No.E/1424(I)/2024-GHZ, Dated: 15.02.2024
DIPR No.950-PP/CL-AGENCY/ADVT./I/2023-24

छत्तीसगढ़ राज्य सहकारी दुग्ध महासंघ मार्यादित
ग्राम-उरला, पो-बी.एम.वाय. चरोदा, जिला-दुर्ग, छ.ग.
क्रमांक /4296/छादुपस/क्रय/2024 दिनांक 16/02/2024

निविदा सूचना

दुग्ध महासंघ द्वारा उरला संयंत्र में स्थापित सी.आई.पी. सिस्टम के अपग्रेडेशन एवं मोडीफिकेशन कार्य एवं प्रारंभ करने हेतु निविदा आमंत्रित की जाती है, जिसकी निविदा जमा करने की अंतिम तिथि 18.03.2024 निर्धारित है, जिसका विस्तृत विवरण दुग्ध महासंघ की वेबसाइट www.cgcoopdairyfed.in पर उपलब्ध है।

प्रबंध संचालक

GIFT GUJARAT INTERNATIONAL FINANCE TEC-CITY COMPANY LIMITED (GIFTCL)

E-Tender Notice for Invitation to Bid for Selection of Contractor for Works on Item Rate Basis

Gujarat International Finance Tec-City Company Limited invite bids from reputed, qualified, experienced and financially sound Contractor for the following Works:

Name of Works	Estimated Cost	Duration	Online availability of Bid Document	Last Date of Online Bid Submission	Last Date of Physical Bid Submission
Supply, Installation, Testing and Commissioning of Water and Sewage Connection to various upcoming developments in DTA, SEZ and Dual Use area of GIFT City	Rs. 2.26 Cr (Excluding GST)	18 (Eighteen) calendar months	17th February 2024 up to 17:00 hrs	16th March 2024 up to 15:00 hrs	17th March 2024 up to 15:00 hrs

(BID Reference No.: GIFT/ENG/WT/WC/2024/02)

Bid document may be downloaded online from website at <https://tender.eprocure.com>
Tender fee of Bid document is Rs.10,000/- payable in the form of Demand Draft / Banker's Cheque / Pay Order in favor of "Gujarat International Finance Tec-City Company Limited" payable at Ahmedabad. For further details and updates please log on to our Website www.giftgujarat.in
Contact Person: Sr. VP (Water) Sd/- Managing Director & Group CEO
Tel: 079-61708300 E-mail: contract@giftgujarat.in

Gujarat International Finance Tec-City Company Limited (GIFTCL)
EPS Building No.49A, Block 49, Zone 04, Gyan Marg, GIFT City, Gujarat, INDIA. Pin-382355.
Tel.: +91 79 61708300, CIN:U75100GJ2007SGC051160

PAR DRUGS AND CHEMICALS LIMITED
CIN: L24117GJ1999PLC035512
Registered office: 815, Nilamber Triumph, GotriVasna Road, Vadodara-390007, Gujarat, India
Phone no.: 0265-2991021, 0265-2991022
Website: www.pardrugs.com Email: investors@pardrugs.com

Statement of Standalone Un-Audited Financial Result for the Quarter and Nine months Ended 31st December, 2023

(Rs. in Lakh except per share data)

Sr. No.	Particulars	Quarter Ending		Year to Date		Year ended
		31.12.2023	30.09.2023	31.12.2022	31.12.2022	31.03.2023
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations	2,422.82	2,593.64	2,297.04	7,311.14	7,146.40
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items ^a)	457.32	653.71	249.64	1,440.77	1,053.98
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items ^a)	457.32	653.71	249.64	1,440.77	1,053.98
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items ^a)	342.22	489.18	186.80	1,078.16	788.71
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	342.22	489.18	186.80	1,078.16	788.71
6	Equity Share Capital (Face Value per share Rs. 10/-)	1,230.46	1,230.46	1,230.46	1,230.46	1,230.46
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-
8	Earnings Per Share of Rs. 10/- Each (for discontinued & continuing operation) Basic as well as Diluted	2.78	3.97	1.52	8.76	6.41

Note: (a) The result has been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meeting held on 16/02/2024. (b) The above is an extract of the detailed format of Statement of Unaudited Financial Result for the Quarter and nine months ended 31st December, 2023 filed with the National Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter and nine months ended 31st December, 2023 are available on the website viz <https://www.nseindia.com/> and the website of the Company at www.pardrugs.com (c) # Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable. (d) The Company is primarily engaged in manufacturing of API, which constitute single business segment in terms of Ind AS - 108 on "Operating Segments". Accordingly, there is no separate reportable segments as per Ind AS - 108.

Date: 16/02/2024
Place: Bhavnagar

For & on Behalf of the Board
Par Drugs And Chemicals Limited
Sd/-
Mr. Falgun V. Savani
(Managing Director)
(DIN: 00198236)

ધિંગાણું : ધારિયાં અને લાકડીઓ ઉછળતાં ગામમાં સોપો , 8 ઈજાગ્રસ્ત માતરના વાલોત્રીમાં દૂધ ભરવાના ઝઘડામાં બે જૂથ વચ્ચે મારામારી

નવગુજરાત સમય > નડિયાદ

■ માતર તાલુકાના વાલોત્રી ગામે ડેરીમાં દૂધ ભરવા બાબતે ભરવાડ અને જાનિયો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બોલાચાલી બાદ સામસામે ભારે પથ્થરમારો અને ધારિયા-લાકડીઓ ઉછળતા બન્ને જુથના લોકો સામ સામે આવી મારામારી શરૂ કરી દીધી હતી. જેમાં આઠ વ્યક્તિઓને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ઈસમોને તારાપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે લીબાસી પોલીસે પચ્ચીસ ઈસમો વિરૂદ્ધ સામસામે ચારોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માતર તાલુકાના વાલોત્રીમાં રહેતા વીરમભાઈ વિક્રમભાઈ ભરવાડના સંબંધી ભાનુભાઈભરવાડ ગામનીડેરીએ દૂધ ભરવા માટે ગયા હતા. આ વખતે



કમલેશભાઈ ઘનશામભાઈ જાદવ, તથા અન્ય પાંચ ઈસમો સાથે દૂધ ભરવા બાબતે બોલાચાલી થતા ભાનુભાઈ ઘરે આવતા રહ્યા હતા. જેની અદાવત રાખી કમલેશ જાદવ સહિત અન્ય પાંચ ઈસમો હાથમાં ધારિયા લાકડીઓ જેવા મારક હથિયાર ધારણ કરીને વિક્રમભાઈના મુકેશભાઈ ભરવાડના ઘરપાસે જઈને વિક્રમભાઈને હરેશભાઈ ભરવાડ, અર્જુનભાઈ ભરવાડ અને ભાનુભાઈ ભરવાડ ઉપર હુમલો કરીને લાકડીઓ અને પાઇપો મારીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ

ગામમાં પોલીસ દ્વારા યુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

આ ઘટનાને લઇને લીબાસી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમજ પરિસ્થિતી વધુ વહાણે નહીં તેમજ ગામમાં શાંતિ અને સુમેળભર્યું વાતવારણ રહે તે માટે પોલીસ સ્ટાફ સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાને લઇને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલમાં પરિસ્થિતી નિયંત્રણ હેઠળ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સામાપક્ષે કમલેશભાઈ જાદવે ભાનુભાઈ ભરવાડ સહિત અર્જુનભાઈ ભરવાડ સહિત દસ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની વધુ વિગતો જોઈએ તો કમલેશભાઈ તથા તેમના પિતા ઘનશામભાઈ ગામની દૂધમંડળીમાં દૂધ ભરવા ગયા હતા તે સમયે ભાનુભાઈ ભરવાડ આવ્યા હતા. અને તેઓએ લાઈન કાપીને દૂધ ભરવા જતા બોલાચાલી થઈ હતી. ત્યારે ભાનુભાઈ ભરવાડે કહયું હતું કે ડેરી અમારા

બાપની છે અમે લાઈનમાં ઉભા રહીશું નહીં આવી અદાવતમાં ભાનુભાઈએ હાથમાં કોદાળી સાથે અન્ય ઈસમોએ છુટ્ટા પત્થરો મારી ઈન્કુબેન, વસંતબેન, ચંદાબેન વગેરેને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ વાલોત્રી ગામમાં બે જુથો વચ્ચે ધમાસાણ મારામારી થઈ હતી. જેમાં બન્ને સમાજના લોકોને શરીરના ભાગે પથ્થરો અને લાકડીઓનો મારવા વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. આઠ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થવાની ઘટના બનતા સમગ્ર ગામમાં સોપો પડી ગયો હતો.

કરમસદના યુવકે વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

નવગુજરાત સમય > આણંદ

■ આણંદ નજીકના કરમસદ ખાતે રહેલા એક યુવકે છ માસ પહેલા એક શખ્સ પાસેથી રૂપિયા 1.30 લાખ વ્યાજે લીધા હતા. પરંતુ સતત માંગણીથી ત્રાસીને તેણે કિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં ભારે ચક્ર્યાર મચી ગઈ છે. આ અંગે વિધાનગર પોલીસે જાણવાજોગ નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કરમસદ ખાતે રહેતો રાહુલસિંહ કમલેશભાઈ પરમાર (ઉ.વ. 26) ડ્રાઈવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. છ માસ અગાઉ તેને આર્થિક કારણોસર નાણાંની રૂપર હોવાથી રાજુ નામના શખ્સ પાસેથી જરૂર 1.30 લાખ વ્યાજે લીધા હતા. પરંતુ આ શખ્સ દ્વારા અવારનવાર વ્યાજની ઉધરાણી કરીને ત્રાસ આપવામાં આવતો હતો. રાહુલભાઈએ વ્યાજ સહિત 4,00,000 જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં રૂપિયા 6,000 નો વ્યાજ અને 6000 ની પેનલ્ટી વસુલ કરતો

છ માસ પહેલા 1.30 લાખ વ્યાજે લીધા હતા , વસુલાતમાં બાઈક પણ પડાવી લીધું

હતું. જ્યારે રાહુલે કિનાઈલ પીતા પહેલાં જ બે પેંજની સ્પ્રુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેના પર રાજુ નામનો શખ્સ ઘેર આવીને કેવી રીતે ઉધરાણી કરતો હતો તે અંગેની વિગત જણાવતાં રાહુલભાઈએ વ્યાજ સહિત 4,00,000 જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં રૂપિયા 6,000 નો વ્યાજ અને 6000 ની પેનલ્ટી વસુલ કરતો

પગલું ભર્યું હોવાનું તેણીએ ઉઠ્યું હતું. જ્યારે રાહુલે કિનાઈલ પીતા પહેલાં જ બે પેંજની સ્પ્રુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેના પર રાજુ નામનો શખ્સ ઘેર આવીને કેવી રીતે ઉધરાણી કરતો હતો તે અંગેની વિગત જણાવતાં રાહુલભાઈએ વ્યાજ સહિત 4,00,000 જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં રૂપિયા 6,000 નો વ્યાજ અને 6000 ની પેનલ્ટી વસુલ કરતો

પગલું ભર્યું હોવાનું તેણીએ ઉઠ્યું હતું. જ્યારે રાહુલે કિનાઈલ પીતા પહેલાં જ બે પેંજની સ્પ્રુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેના પર રાજુ નામનો શખ્સ ઘેર આવીને કેવી રીતે ઉધરાણી કરતો હતો તે અંગેની વિગત જણાવતાં રાહુલભાઈએ વ્યાજ સહિત 4,00,000 જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં રૂપિયા 6,000 નો વ્યાજ અને 6000 ની પેનલ્ટી વસુલ કરતો

ખંભાતના જલુંધ ગામમાં ખેતરમાં પાકના રક્ષણ માટે મૂકેલા વીજકરંટથી વૃદ્ધનું મોતઃ બાળા દાઝી

» વીજકરંટ મુકનાર ખેડૂત સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી

નવગુજરાત સમય > આણંદ

■ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જલુંધ ગામે ભાગે કરેલા ખેતરમાં શક્કરીયાના પાકમાં વાંદરા અને ભૂડું નુકસાન ન કરે તે માટે એમજીવીસીએલના વીજપોલના ચાલુ વીજપ્રવાહના વાયર પર લોખંડના તારના છેડા ને વાંસની મદદથી લગાવી વીજકરંટ ખેતરમાં પાથરી રાખતા નજીકમાં રહેતા નાના અને ભાણીને વીજકરંટ લાગ્યો હતો. જેમાં ગંભીર રીતે દાઝી જતાં નાનાનું મોત નીપજ્યું હતું અને ભાણીને ઈજાઓ થઈ હતી. આ બનાવ અંગે ખંભાત રૂરલ પોલીસે ફરિયાદ લઈ વીજ કરંટે મુકનારા વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ખંભાત તાલુકાના જલુંધ ગામે શિવરામપુરા વિસ્તારમાં પરેશભાઈ નરસિંહભાઈ

પરમાર પોતાના પિતા નરસિંહભાઈ છોટાભાઈ પરમાર, માતા મધુબેન તેમજ તેઓના બહેન રીટાબેન પોતાની ૩ વર્ષીય ભાણી સાક્ષીબેન સાથે રહે છે. પરેશભાઈના બેન રીટાબેન છેલ્લા બે વર્ષથી પોતાની દીકરી સાથે ભાઈના ઘરે જ રહે છે. પરેશભાઈ પરમારના ઘરની નજીકમાં ખંભાત ખાતે રહેતા એયુબભાઈ કાદરભાઈદલવાડીનું સર્વેનંબર 442 વાળું ખેતર આવેલું છે. આ ખેતર નજીકમાં રહેતા રતનભાઈ રમણભાઈ પરમાર ભાગેથી ખેડે છે અને નજીકમાં જ રહેતા રામસિંહભાઈ ફુલાભાઈ પરમાર પણ પરેશભાઈના ઘરની નજીકમાં બાજુભાઈ ભુપતભાઈનું ખેતર ભાગેથી કરેલ છે. જેમાં રામસિંહભાઈ પરમારે શક્કરીયાં નો પાક કર્યો છે. રામસિંહભાઈ પરમારે પોતે ભાગે કરેલા ખેતરમાં શક્કરીયાના પાકને વાંદરા અને ભૂડું નુકસાન ન કરે તે માટે એયુબભાઈ કાદરભાઈ દલવાડીના ખેતરમાં આવેલા એમજીવીસીએલના વીજપોલના ચાલુ વીજ પ્રવાહના વાયર

પર મકાનના બાંધકામના સેન્ટીગમાં વપરાતા લોખંડના તારના એક છેડાને વાંસડાની મદદથી લગાવી તારનો બીજો છેડો ખેતરમાં પાથરી દઈને તેમાં વીજપ્રવાહ પસાર કર્યો હતો.

બીજી તરફ આ બાબતથી અજાણ પરેશભાઈના પિતા નરસિંહભાઈ છોટાભાઈ પરમાર ત્રણ વર્ષથી ભાણી સાક્ષીને લઈને ત્યાંથી પસાર થતાં હતા ત્યારે ગત તારીખ 10મીના રોજ ખપોરના ભાર વાગ્યના અરસામાંમાં વીજ કરંટે લાગતા નરસિંહભાઈ તેમજ સાક્ષીબેન શરીરે દાઝી ગયા હતા. જેથી બંનેને તાત્કાલિક સારવાર માટે ખંભાત જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે નરસિંહભાઈને મરણ પામેલા જાહેર કર્યા હતા.

જ્યારે સાક્ષીબેનને શરીરે દાઝી જવાથી ઈજાઓ તથા સારવાર કરી વધુ સારવાર માટે બાળકોના ડોક્ટર મયુર મહેતાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પરેશભાઈ નરસિંહભાઈ પરમારની ફરિયાદ લઈ ખંભાત રૂરલ

પોલીસે વીજકરંટ ઉતારનાર રામસિંહ પરમાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદમાં આંગણવાડી કાર્યકરોનો બે દિવસની હડતાલ સાથે વિરોધ




નવગુજરાત સમય > આણંદ

■ આણંદ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કામ કરતી આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બે દિવસની હડતાલ શરૂ કરાઈ છે. જેમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકાર દ્વારા પગારમાં વધારો અને વિવિધ માંગણીઓ સાથે બજેટના આવરી લેવા સરકાર દ્વારા જણાવ્યું હતું. પરંતુ બજેટના ફક્ત આયુષાના કાર્ડના જ આવરી લેતાં આંગણવાડી બહેનોએ રજા રીપોર્ટ મુકીને બે દિવસ ની હડતાલ પર ઉતર્યો છે. આ બહેનોએ જણાવ્યું કે તેમની પાસે સોથી વધુ કામ લેવામાં આવે છે અને પૂરતી સુવિધાઓ ઉપાધી નથી તથા પગાર પણ ખૂબ ઓછો આપવામાં આવે છે અને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે જે બાબતે આણંદમાં એકત્ર થઈ પરણા અને સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

જાહેર નિવેદા નં.૨૦ સને ૨૦૨૩-૨૪

ગુજરાત સરખના સચ્ચપાલવતી કાર્ડપાલક છજનેરમી, અવાદ ભંકર (પા અને મા) વિભાજ, હાંતીલોક, ત્રીજો માણ, એમ.એસ.નિલ્ડિંગ, વસાપુર સરકારી વસાહત, કાંઇવ. ઉન રોડ, અમદાવાદ-૫૨ ની કચેરીએથી બંદાજત રકમ રૂ.૪૩.૧૩ લાખના કુલ : ૧ (એક) કામો માટે ગુજરાત સરખના સિસાહ તસા માર્ગ અને મસાન વિભાજની યોગ્ય શ્રેણીના નોંધાયેલ માલ્ય છજારદારશ્રીએ પાસેથી ઓનલાઇન ટેન્ડર માંગવામાં આવે છે. આ કામના ટેન્ડરો <https://tender.npscure.com> ઉપર જોવા મળશે. અને આ સપ્દ ઉપરથી ઓનલાઇન ટેન્ડરો કાઉનલોક તા.૨૦/૦૪/૨૦૨૪ થી તા.૦૫/૦૩/૨૦૨૪ ના રોજ ૧૮:૦૦ કલાક સુધી કરી શકશે. ટેન્ડરો રૂબરૂ/પાલશી સ્વીકારવામાં આવશે નહીં. શબ્દ કરો તો ટેન્ડરો તા.૦૬/૦૩/૨૦૨૪ ના રોજ ૧૨:૦૦ કલાકે ઓનલાઇન સહમ કક્ષાએ ખોલવામાં આવશે. ઓનલાઇન ટેન્ડરો અંગે અપલોક કરવાની છેલ્લી તારીખ સુધીમાં આ કચેરી તરફથી કરવામાં આવેલ સુધારાવાધારા ઓનલાઇન જ કરવામાં આવશે જે છજારદારશ્રીએ ધ્યાને લેવાના રહેશે અને ત્યારબાદ ભાવો ભરવાના રહેશે. આ બાબતે છજારદારશ્રીની અંત્ય જવાબદારી રહેશે. આ ઉપરાંત વિજતવાર નોટીસ માફિની ખાતાની વેબસાઇટ www.statetenders.gujarat.gov.in પર તથા કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવેલ છે. આ નોટીસ અંગેની વધુ માહિતી માટે ઉપરોક્ત કચેરીની જાહેર રજા સિવાયના કામના દિવસોમાં રસ ધરાવતા છજારદારશ્રીઓએ રૂબરૂ સંપર્ક સાધવા વિનંતી છે.

ક્રમાંક/સંખ્યા/નિ/અમદ/૧૬૨૩/૨૦૨૪

<div> <div> બૈંક ઑફ ઇન્ડિયા Bank of India BOI Relationship beyond banking </div> <div>  </div> </div>	<div> <div> એસેટ રીકવરી ડિપાર્ટમેન્ટ <div> કસ્ટો માળ, બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ, ભા.ક, અમદાવાદ, ફોન ૦૭૯-૨૬૨૧૧૨૧૨, ૨૬૨૧૨૧૩૩૦ </div> </div> <div> પરેરાની નોટીસ (સ્થાયે મિલકતો માટે) </div> </div>	<div> નિયમ-૮ (૧) </div>		
<p>આથી, બેંક ઓફ ઇન્ડિયાના અધિકૃત અધિકારીશ્રીએ લિક્વોરિટાઈઝેશન ઝેન્ડ રિકન્વેટકશન ઑફ કાર્પોનાન્સિયલ એસેટ્સ ઝેન્ડ એન્ડગ્રોસમેન્ટઝાઉફ લિક્વોરોટી ઇન્વેસ્ટેર અધિનિયમ, ૨૦૦૨, અન્વયે અને લિક્વોરિટી ઇન્વેસ્ટેર એન્ડગ્રોસમેન્ટ નિયમ - ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) અન્વયે મળેલી સલાની રૂએ આથી નોટિસ આપવામાં આવે છે કે નીચે દર્શાવેલા ખાતાઓના સંબંધિત ઉધારકર્તાઓ / જમીનદારોને અને લોન/ નાણાકીય સહાય માટે આપવામાં આવતી બેંકની અગ્ર સગવડ અંતર્ગત નીચે જણાવેલ તારીખોએ મંગલનો નોટિસો જારી કરીને સદરુદ્ધ નોટિસો મળ્યાની તારીખથી ૬૦ દિવસમાં જે તે બાકી રકમ તથા ચડત વ્યાજ સાથે પરત ચૂકવવા જણાવેલ. સંબંધિત ઉધારકર્તાઓ / જમીનદારો ઉપરોક્ત રકમ ચૂકવવામાં કસુરવાર થતાં આથી સંબંધિત ઉધારકર્તાઓ / જમીનદારોને તથા જાહેર જનતાને લેવા ઉધાર જનતાને લેવા ઉધાર આપવામાં આવે છે કે અધિનિયમ ૧૩(૧) અંતર્ગત નિયમ ૮ સાથે વંચાલો લેતાં આપેલી સલાની રૂએ ઓઈદત્તાસરોએ નીચે જણાવેલ તારીખે સંબંધીત ઉધારકર્તાઓ / જમીનદારોની નીચે જણાવેલ મિલકતનો કબજો લઈ લીધેલ છે. સંબંધિત ઉધારકર્તાઓ / જમીનદારોને અને એઈદદે આમ જનતાને આથી ચેલેન્જી આપવામાં આવે છે કે નિર્ભાગિત મિલકતો સંબંધિત કોઈ વ્યવહાર ન કરે અને ઝાવો કોઈપણ વ્યવહાર ખાતાઓની નીચે મુજબ દર્શાવેલી જે તે રકમ તથા ચડત વ્યાજ, આજ રોજ થી પરત ચૂકવણીની તારીખ સુધીના આનુસંધિક ખર્ચાં, કોસ્ટ, ચાર્જિસના બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદ ના બોળને અધિન રહેલો. સદરુદ્ધ કાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ પ્રત્યે સંબંધિત ઉધારકર્તાનું ધ્યાન દોરવામાં આવે છે કે મુકરર મિલકતો છોડવા માટે સમય આપવામાં આવે છે.</p>				
અ. નં.	ઉધારકર્તાનો/ રાજાનું નામ	કીમાલ નોટીસની તારીખ / બાકી લેલા (રૂ.)	સ્થાયર મુકલ મિલકતનું વર્ણન	પરેરાની તારીખ/ પ્રકાર
૧	મેસાર્ સાંખલા કલચ પ્લેટ રિપેરર્સ (ખોમા રસોદાખાનુ શોકીમભોદમદ સાંખલા શાખા અમદાવાદ મેળન રાખા	૦૩.૦૫.૨૦૨૩ રૂ. ૬૫,૬૦,૦૫૮.૫૪/- (રૂ. પંચાણું લાખ નેણું હજાર સાતસો અઠ્ઠાવન અને ચુંબોતે પેસા કુલત)	મેસાર્ સાંખલા કલચ પ્લેટ રિપેરર્સની માલિકીની ફેક્ટરી જમીન અને બિલ્ડિંગ, પ્લોટ નં. ૬૦૧/૫૫/૧૮૦ ખાતે સ્થિત, સર્વે નં. ૩૬૪/૫૫, કોકા કોલા પ્લાન્ટ સામે, સાઈદ છુસાઈડીસી, ફેગ-૨, ગામ - બોલ, તા. સાઈદ, કિરોડી અમદાવાદ ખાતે ઝામેલ સમગ્ર મિલકત જેની ચર્ચુસીમા: પૂર્વ: પ્લોટ નં. ૬૦૧/૫૫/૧૮૬, પશ્ચિમ: ૦.૫ મીટર પ્લોટ/ ૬૦૧/૫૫/૧૮૬ પ્લોટ) રસ્તા, ઉત્તર: પ્લોટ નં. ૬૦૧/૫૫/૧૮૬, દક્ષિણ: ૧ મીટર પ્લોટ/ ૬૦૧/૫૫/૧૮૬ અને ૧૨ મીટર પ્લોટ) રસ્તા.	૧૧.૦૨.૨૦૨૪ પ્રચલ્ય કલચ
૧	શ્રી વિનોદકુમાર કાંતિલાલ મહેતા અને કીમતી દામેલન વિનોદકુમાર મહેતા રાખા: એલિસાઈંગ રાખા	૨૩.૧૧.૨૦૨૩ રૂ. ૧૬,૨૬,૫૬૧.૨૪/- (રૂ. સોળ લાખ છત્તોલ્લ હજાર પાંચસો એઠ્ઠાઠ અને ચોવીસ પેસા કુલત)	સ્થાયર મિલકત કુલેટ નં. બી/૫૦૨ મોળાં માળ (મંજૂર થયેલ પ્લાન પ્રમાણે ચોમો માળ) સુપર બિરગમ એલિયા કોમ્પ્લેક્સ ૧૧૧ રહે. ચાકુડાં એટેલે કે ૬૬, ૧૫ રહે. મીટરે કારનાના કેસીડીની વડીલે બાણીટી સ્ટીમમાં ઝામે અધિભાગુત્વા લાયકેસાયેલ ભાગ સાથે કોમન એમેનિટીસ કોમ્પ્લેક્સ ૫૫.૬૧ રહે. ચાકુ એટેલે કે ૩૦ રહે. મીટર સર્વે નં. ૧૫૩૮ પર ઝામેલ જમીન પર થયેલ બાંધકામ જેનું કોમ્પ્લેક્સ ૨૦૨૩ રહે. મીટરે કુલેટ રીપીટ સ્ટીમ નં. ૧ કમ્પ્લેવેલ કમ્પાઈલ પ્લોટ નં. ૧૦૪ જમીન એલિયા કોમ્પ્લેક્સ ૧૧૧૪ રહે. મીટરે ગામ / મોળે મોળેખ ખાતે ઝામેલ અને સ્થિત, તાકુકા દસ્તોઈ, કિરોડીક અમદાવાદ ઝામે રાખ કિરોડીક અમદાવાદ - ૧૧ (અસાવવી) ખાતે ઝામેલ સમગ્ર મિલકત જેની ચર્ચુસીમા: પૂર્વ: ખેતીલાકય જમીન, પશ્ચિમ: કુલેટ નં. બી/૫૦૧, ઉત્તર: ખેતીલાકય જમીન, દક્ષિણ: કુલેટ નં. બી/૫૦૩.	૧૬.૦૨.૨૦૨૪ સાંકેલિક કલચ
તારીખ : ૧૧.૦૨.૨૦૨૪, ૧૬.૦૨.૨૦૨૪, રથાળ : અમદાવાદ				સહી/- અધિકૃત અધિકસરી, બેંક ઓફ ઇન્ડિયા

» ભાદરવા, ફેરકુવા, રૂપપુરા અને સુરવાના ગ્રામજનોએ કહ્યું ‘અમે એરપોર્ટે બનાવવા સરકારને જમીન નહીં આપીએ’

નવગુજરાત સમય > રાણપીપળા

■ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સરકારે તિલકવાડા નજીકના પંથક, ભાદરવા અને સુરવા વચ્ચે એરપોર્ટે બનાવવાની ક્વાયત હાથ ધરી છે.એરપોર્ટે કોન્ક્રિટવિટીને લઈને રાખ સરકાર દ્વારા પ્રી-કીટીબિલીટી સ્ટડીની કામગીરી કરવામાં આવી રહી છે.એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક ફેરકુવા, ભાદરવા અને સુરવા ગામની 210 હેક્ટર ખાનગી જમીન એરપોર્ટ વિકસાવવા સંદેહ કરી સંપાદન કરવા સરકાર પાસેથી મંજૂરી મેળવવામાં આવી છે. તો બીજી બાજુ એરપોર્ટની કામગીરી શરૂ થાય એ પહેલા જ ભાદરવા, ફેરકુવા, રૂપપુરા અને સુરવાના ગ્રામજનોએ એરપોર્ટે બનાવવા સરકારને એક ઈય પણ જમીન નહિ આપવા એક સૂર નક્કી કરતા સરકાર અને તંત્ર અવધવમાં મુકયા છે.



હતું.જેમાં આ ચાર ગામના લોકોએ એરપોર્ટે માટે જમીન આપવા મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ચાર ગામના લોકોએ એક સુરે વિરોધ કરતા જણાવ્યું હતું કે સરકારે પ્રવાસીઓની સુવિધા માટે અમારા બાપદાદાની સ્વતંત્ર જમીન ઉપર એરપોર્ટે બનાવવા માટે જાહેરાત કરી છે.અમે મુળ આદિવાસીઓ છીએ, સદીઓથી ઉડાણ વિસ્તારોમાં રહી માત્રને માત્ર ખેતી ઉપર અમારા કુટુંબનું ગુજરાત ચલાવીએ છે, અમારા ગામમાં કોઈ પણ પ્રકારની રોજગારી આવેલી નથી.અમારી સ્વતંત્ર માલિકીની જમીનમાં એરપોર્ટે બનાવવામાં આવે તો અમે બેધર અને તદ્દન જમીન વિહોણા બની જઈશું.અમારું જીવન ગુજારવાનો કોઈ જ આધાર નહીં રહે. અમારી ભવિષ્યની પેઢીને જીવવું ખૂબ જ મુશ્કેલ બની જશે. અમે એરપોર્ટે બનાવવા માટે એક ઈય પણ જમીન નહીં આપીએ. એરપોર્ટે અન્ય જગ્યાએ બનાવવા હુકાર કર્યો છે.

હરણી લેકઝોન ખાતે બોટીંગ જોખમી હોવા છતાં ચાલુ રાખવાનું દબાણ કરનારની તપાસ કરાશે



» હોડી હોનારતના સૂત્રધાર પરેશ શાહના દીકરાના 5 અને બે મહિલાઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર નવગુજરાત સમય > વડોદરા

■ ભાર બાળકો અને બે શિક્ષકોના ભોગ લેનાર વડોદરાના હરણી લેકઝોનમાં બનેલી હોડી હોનારતના મુખ્ય સૂત્રધાર પરેશ શાહના પરિવારના ઝડપાયેલા ત્રણ સભ્યોને આજે અદાલતમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેમાં પરેશ શાહના પુત્રને 5 દિવસના તથા તેમના પત્નિ સહિત બે મહિલાઓના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. એસઆઈટી દ્વારા અદાલતમાં રજૂ કરવામાં આવેલી રિમાન્ડ અરજમાં જણાવ્યું હતું કે, હરણી લેકઝોનના પ્રોજેક્ટમાં ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે આર્થિક નુકસાન જતાં આરોપીઓએ યેનકેન પ્રકારે પોતાના નુકસાનની ભરપાઈ કરવા પ્રયાસ શરૂ કરી દીધા હતા. વધુ એકાં લાભ મેળવવા સલામતીના

જાહેર નોટીસ :-

મુસદ્દા રૂપ નગર રચના યોજના નં.૧૧ (સદજ) આથી જાહેર જનતાને જણાવવાનું છે. મુસદ્દારૂપ નગર રચના યોજના નં. ૧૧ (સદજ)ની દરખાસ્તો બાબતે યોજનામાં સમાવિષ્ટ જમીન માલિકો/હિત સંબંધ ધરાવતા તમામ વ્યક્તિઓને અગેરે કચેરી બાર પ્રાપ્ત સરનામાંઓને આધારે વ્યક્તિગત નોટીસો બજાવીને, તેઓના વાંધાસૂચનો રજૂ કરવા જણાવી સૂનવણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે, પરંતુ કોઈ જમીનમાલિકો/હિત સંબંધ ધરાવનાર વ્યક્તિઓને સદર મુસદ્દારૂપ નગર રચના યોજનાની દરખાસ્તોની નોટીસ પુરતા સરનામાંને અભાવે કે બીજા કોઈ કારણોસર મળેલ ન હોય તો પ્રાથમીક પુરાવા તથા જમીનમાલિકી હક્કના અધિકૃત આધાર પુરાવા સાથે અગેરેની કચેરીએ રૂબરૂ અથવા લેખીત વાંધા સૂચનો સાથે આ કચેરીના નીચે જણાવેલ સરનામે ટિન-૭ ના રજૂ કરવા વિનંતી છે. તે છતાં રજીષ્ટ્રાત કરવામાં આવેલો નહીં તો અગેરેની લેવામાં આવેલ નિર્ણય જે તે જમીન માલિકોને/હિતસંબંધ ધરાવતી વ્યક્તિઓને બંધનકર્તા રહેશે. જેની નોંધ લેવા વિનંતી છે.

નગર રચના અધિકારી,
નગર નિયોજક-૩
અમદાવાદ નગર રચના યોજના એકમ-૧,
અમદાવાદ.

કચેરીનું સરનામું:-
નગર રચના અધિકારીબીની કચેરી,
નગર નિયોજક-૩,
અમદાવાદ નગર રચના